

જે ઉમેદવારે ધોરણ ૧૦+૨ ફક્ત સામાન્ય પ્રવાહ અથવા વિજ્ઞાન પ્રવાહ સાથે ઉત્તીર્ણ કરેલ હોય તેઓ ડિપ્લોમાં ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી (GNM) (હાલમાં ૩ વર્ષનો કોર્સ) તથા ઓકઝીલરી નર્સિસ મિડવાઇવ્ઝ (ANM) (હાલમાં બે વર્ષનો છે.) કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે. GNM/ANM કોર્સની માન્યતા ગુજરાત સરકાર, ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ આપે છે.

અત્રે જણાવેલ વિગતો માત્ર પ્રાથમિક જાણકારી માટે છે પ્રવેશના નિયમો નથી.

ANM અને GNM કોર્સ માટેની વર્ષ ૨૦૧૭-૨૦૧૮ ની પ્રવેશ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થનાર છે. આ વર્ષની પ્રવેશ પ્રક્રિયા (સરકારી સ્કૂલો ની તમામ સીટો તથા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની ૭૫% સીટો) ઓનલાઇન પ્રક્રિયા ધ્વારા કરવાની હોવાથી વિદ્યાર્થી તથા વાલીઓ એ નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લેવા જણાવવામાં આવે છે.

1. **સૌ પ્રથમ એક્સિસ બેંક ની નક્કી કરેલ શાખા માંથી રૂ.૧૫૦ ચૂકવીને પીન (PIN) ખરીદવાની રહેશે.**
(એક્સિસ બેંક ની નક્કી કરેલ શાખાઓ ની વિગત કમિટી ની વેબસાઇટ <http://www.medadmgujarat.org/ga/home.aspx> પર મુકવામાં આવશે.)
2. નિયમો તથા માહિતી પુસ્તિકા કમિટી ની વેબસાઇટ પર મુકવામાં આવશે.
3. **પીન (PIN) મેળવ્યા પછી કમિટી ની વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે (રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે).**
4. ગુજરાત બોર્ડ / CBSE / ICSEનાં વિદ્યાર્થીઓ કે જેમણે ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ ની પરીક્ષા ગુજરાત રાજ્યમાંથી ઉત્તીર્ણ કરેલ છે, તેઓએ વેબસાઇટ પર જ્યાં ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાંથી લોગ ઓન કરી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી કમિટી ધ્વારા નક્કી કરવામાં આવેલ હેલ્પ સેન્ટર પર જઈને કરી શકાશે. (હેલ્પ સેન્ટરો ની વિગત કમિટી ની વેબસાઇટ પર મુકવામાં આવશે.)
5. **ઓનલાઇન ફોર્મ ભરતી વખતે નીચે મુજબની માહિતી સાથે રાખવી.**
 1. પિન નંબર (PIN Number)
 2. સ્કેન કરેલ પાસપોર્ટ સાઈઝ નો ફોટોગ્રાફ (100 KB થી વધુ નહીં)
 3. સ્કેન કરેલ સહી નો નમૂનો (100 KB થી વધુ નહીં)
 4. ધોરણ -૧૨ ની માર્કશીટ (તમામ પ્રયત્નોની)
 5. ધોરણ -૧૦ ની માર્કશીટ (તમામ પ્રયત્નોની)
6. ઓનલાઇન ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢવાની રહેશે.

7. ત્યારબાદ તમામ ઉમેદવારોએ ફરજિયાત હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવા જવાનું રહેશે. ડોક્યુમેન્ટની ચકાસણી થયા પછી હેલ્પ સેન્ટરમાં થી પાવતી આપવામાં આવશે જે સાચવીને રાખવી
8. દરેક ઉમેદવારે હેલ્પ સેન્ટર ખાતે રજીસ્ટ્રેશન પ્રમાણિત કરી Registration Slip મેળવવી ફરજિયાત છે, તે સિવાય ઉમેદવાર આગળની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં.
9. ડોક્યુમેન્ટની ચકાસણી વખતે નીચે મુજબના ડોક્યુમેન્ટ ઓરીજનલ તથા સ્વપ્રમાણિત ઝેરોક્ષ ફરજિયાત સાથે રાખવા. (ઝેરોક્ષ હેલ્પ સેન્ટર ખાતે જમા લેવામાં આવશે) -અપૂરતા ડોક્યુમેન્ટ સ્વીકારવા માં આવશે નહીં.
- ધોરણ -૧૨ ની માર્કશીટ (તમામ પ્રયત્નોની)
 - ધોરણ -૧૦ ની માર્કશીટ (તમામ પ્રયત્નોની)
 - L.C. - શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (CBSE નાં ઉમેદવારો માટે માઈગ્રેશન સર્ટીફિકેટ)- ઝેરોક્ષ બે નકલમાં
 - જાતિનો દાખલો (લાગુ પડતું હોય તો))- ઝેરોક્ષ બે નકલમાં
 - SEBC ઉમેદવારનું ૧/૪/૨૦૧૬ પછીનું નોન ક્રીમી લેયર સર્ટીફિકેટ (લાગુ પડતું હોય તો))- ઝેરોક્ષ બે નકલમાં
- વિધવા કેટેગરીના ઉમેદવાર માટે
- પતિના મૃત્યુનું પ્રમાણપત્ર
 - નમુના મુજબનું અધિકૃત અધિકારી નું પ્રમાણપત્ર (પ્રમાણપત્ર નો નમૂનો વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.)
- અનાથ કેટેગરીના ઉમેદવાર માટે
- માતા અને પિતાનો મરણનો દાખલો
 - નમુના મુજબનું અધિકૃત અધિકારી નું પ્રમાણપત્ર (પ્રમાણપત્ર નો નમૂનો વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.)
- છૂટાછેડાના કેટેગરીના ઉમેદવાર માટે
- છૂટાછેડા માટે કોર્ટનો આદેશ
 - નમુના મુજબનું અધિકૃત અધિકારી નું પ્રમાણપત્ર (પ્રમાણપત્ર નો નમૂનો વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.)
- શારીરિક ખોડ-ખાંપણ કેટેગરીના ઉમેદવાર માટે
- વિકલાંગતાનું પ્રમાણપત્ર ફોટા વાળું
- ANM કેટેગરીના ઉમેદવાર માટે
- ANM ની માર્કશીટ
 - ANM નું GNC રજીસ્ટ્રેશન

- ગૌણ સેવા પસંદગી પાસ કર્યા પછી કાયમી નિમણુકનો આદેશ
- છેલ્લી પગાર સ્લીપની ઝેરોક્સ
- CDHO નું નમુના મુજબનું N.O.C.

10. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આપ જે પાસવર્ડ લખો તે સાચવીને રાખવો.

11. યોઈસ ફિલિંગ પ્રક્રિયા દરમ્યાન પાસવર્ડ ની જરૂર પડશે.

12. આપને મળેલ પીન (PIN) માં લખેલ સીરીયલ નંબર આપનો યુઝર આઈડી (User ID) છે.

13. ડોક્યુમેન્ટની ચકાસણી પછી એડમિશન કમિટી ધ્વારા વેબસાઈટ પર મેરીટ લિસ્ટ પ્રસિધ્ધ કરવામાં આવશે અને તે પછી સંસ્થાની પસંદગી (Choice Filling) પ્રક્રિયા ઓનલાઈન હાથ ધરવામાં આવશે.

14. પ્રવેશ માટે ઉપલબ્ધ સંસ્થા તથા સીટો ની માહિતી તથા ફી ની વિગતો વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે.

15. મેનેજમેન્ટ ક્વોટા ની સીટો પર પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ એડમિશન કમિટી ના ફોર્મ ઉપરાંત મેનેજમેન્ટ ક્વોટા માટેનું અલગથી ફોર્મ ભરવાનું રહેશે.

16. પ્રવેશ સમિતિ દ્વારા નિર્ધારિત સમય પત્રક વખતો વખત વેબસાઈટ પર જોતા રહેવું.

17. ચેતવણી: આપનો પાસવર્ડ તથા ખરીદેલ PIN ગુપ્ત રાખશો. જો તમારો PIN ખોવાય જાય તો સીસીઆર, જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, ગાંધીનગર ખાતે રૂબરૂમાં આવી રૂ. ૧૦૦/- ભરી પુનઃ પ્રાપ્ત કરી શકાશે.

18. દિવ્યાંગ (શારીરિક ખોડખાંપણવાળા) (PH) ઉમેદવાર માટે: PH ક્વોટા માટે અરજી કરતા તમામ ઉમેદવારોને ડિસેબિલિટી માટે મેડિકલ બોર્ડ સમક્ષ પરીક્ષણ માટે કમિટી ની ઓફિસ, જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, ગાંધીનગર ખાતે હાજર રહેવું પડશે. મેડિકલ બોર્ડ દ્વારા જારી કરાયેલા સર્ટિફિકેટ જ માન્ય ગણવામાં આવશે. અન્ય કોઈપણ સત્તાવાળા/ હોસ્પિટલ દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે નહિ.